



RAN-2508000605040003

T. Y. B. Com. (Sem. - V) Examination October - 2025
Minor - Advanced Accounting and Auditing (Paper - V)

Time: 2 Hours]

[Total Marks: 50

સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
 Fill up strictly the above details on your answer book.

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

પ્ર. 1. ટૂંકમાં જવાબ આપો. (ગમે તે પાંચ)

(10)

1. નિત્ય તપાસ એટલે શું?
2. હિસાબી ગોટાળા એટલે શું?
3. આંતરિક અંકુશની પદ્ધતિના લક્ષણોની યાદી આપો.
4. ટીમિંગ અને લેડિંગ એટલે શું?
5. પ્રાચીન ભારતીય ઓડિટિંગના હેતુઓ જણાવો.
6. વાઉચિંગના ઉદ્દેશો જણાવો.
7. મિલકતોનું મૂલ્યાંકન એટલે શું?

પ્ર. 2. ઓડિટના પ્રકારો જણાવો તેમજ સતત ઓડિટ એટલે શું? તેના ફાયદાઓ અને મર્યાદાઓ જણાવી તે ખાસ કરીને કયા ધંધાઓને લાગુ પડે તે જણાવો.

(14)

અથવા

- પ્ર. 2. અ. પ્રાચીન ભારતીય ગ્રંથોમાં વર્ણવેલી ઓડિટિંગની પ્રક્રિયા સમજાવો.**
બ. નવું ઓડિટ શરૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ સમજાવો.

(07)

(07)

પ્ર. 3. અ. નીચેના વ્યવહારોનું વાઉચિંગ કેવી રીતે કરશો?

(07)

1. દેવાદાર પાસેથી મળેલ રોકડ
2. પ્રાથમિક ખર્ચ

બ. નીચેની ચકાસણી કેવી રીતે કરશો.

(07)

1. પાઘડી
2. સંભવિત જવાબદારીઓ

અથવા

પ્ર. 3. અ. આદર્શ આંતરિક અંકુશની પદ્ધતિના લક્ષણો સમજાવો.

(07)

બ. વાઉચિંગ અંગે ઓડિટરની ફરજો જણાવો.

(07)

પ્ર. 4. ટૂંક નોંધ લખો. (ગમે તે ત્રણ)

(12)

1. ઓડિટિંગના ઉદ્દેશો.
2. ચકાસણી અંગે ઓડિટરની ફરજો.

3. આંતરિક ઓડિટના ફાયદા.
4. ઊંડાણપૂર્વકનું ઓડિટ.
5. પ્રાચીન ભારતીય ઓડિટિંગ અને આધુનિક ભારતીય ઓડિટિંગ વચ્ચેનો તફાવત

ENGLISH VERSION

- Q. 1. Answer in short (Any Five) (10)**
1. What is routine checking?
 2. What is accounting fraud?
 3. Give the features of system of internal control.
 4. Give the meaning off Teeming and Lading.
 5. Explain the purpose of ancient Indian auditing.
 6. State the objectives of vouching.
 7. What is the meaning of valuation of property?
- Q. 2. Write the types of Audit and what is continuous audit? Explain its advantages and disadvantages and tell which business it is particularly applicable. (14)**
- OR**
- A. Explain the process of auditing as described in ancient Indian scriptures. (07)**
- B. Which points should be taken into consideration by the auditor at the time of starting the new audit? (07)**
- Q. 3. A. Explain vouching of. (07)**
1. Cash received from debtors.
 2. Preliminary Expenses
- B. How to check the following. (07)**
1. Goodwill
 2. Contingent Liabilities.
- OR**
- Q. 3. A. Explain the characteristics of an ideal internal control system. (07)**
- B. Explain the duties of an auditor regarding vouching. (07)**
- Q. 4. Write Short notes. (Any Three) (12)**
1. Objectives of auditing.
 2. Auditor's duties regarding verification.
 3. Benefits of Internal audit.
 4. Auditing in depth.
 5. Difference between Ancient Indian auditing and modern Indian auditing.